

S.Y.B. Sc. Examination

March -April 2016

Code no.8415

Zoology Paper Z – 201

Time: 2 Hours

Total Marks – 75

સુચના: ૧. બધાજ પ્રશ્નો ફરજીયાત છે.

૨. જમણી બાજુના અંકડા પ્રશ્ન ના ગુણે દર્શાવે છે.

૩. જરૂર જણાય ત્યાં નામનીદેશન વાળી આકૃતિ દોરો.

પ્ર ૧. અ .પાચલા નું ચેતા તંત્ર આકૃતિ સહ વર્ણવો. 10

બ .કોષાન્ત્રી સમુદ્દરયાના સામાન્ય લક્ષણો લખી તેનું વર્ગ સુધીનું વર્ગીકરણ ઉદાહરણ સહ લખો.

અથવા

પ્ર ૧. અ .પાચલા નું પાચન તંત્ર આકૃતિ સહ વર્ણવો. 10

બ .મુદ્દકાય સમુદ્દરયાના સામાન્ય લક્ષણો લખી તેનું વર્ગ સુધીનું વર્ગીકરણ ઉદાહરણ સહ લખો.

પ્ર ૨. વર્ણવો .અ :આકૃતિ સહ જળો નું ચેતા તંત્ર. 10

બ .મેલેરિયા ના લક્ષણો, તેનું નિયંત્રણ અને અટકાવવા માટેના ઉપાયો લખો.

અથવા

પ્ર ૨. વર્ણવો .અ :આકૃતિ સહ જળો નું પાચન તંત્ર. 10

બ .પ્લાઝ્મોડીયમ વાયવેક્સ નું જીવન ચક .(આકૃતિ જરૂરી)

પ્ર ૩. વર્ણવો .અ :યકૃત કૂમિ ના વિવિધ ડીમ્સો. 10

બ .કરમીયું .(આકૃતિ જરૂરી)

અથવા

પ્ર ૩. વર્ણવો .અ :આકૃતિ સહ યકૃત કૂમિ નું પ્રજનન તંત્ર. 10

બ .જુઓ અને ઢોર ની ઈતઠી.

પ્ર ૪. અ .સમજવો : મોતી છીપમાં મોતી ઉછેર. 09

બ:વર્ણવો . પેરાગોનીમસ વેસ્ટરમની.

અથવા

પ્ર ૪ . અ. હાથીપગાનો રોગ વર્ણવો. 09

બ .મુદ્દકાયો ની આર્થિક અગત્યતા લખો.

S.Y.B. Sc. Examination

March -April 2016

Code no. 8415

Zoology Paper Z – 201

Time: 2 Hours

Total Marks – 75

- Instruction: 1) Attempt all questions
2) Figures on right indicate the marks.
3) Draw labelled diagram wherever required.

Q-1 a. Describe: Nervous system of Pila (with diagram). 10

**b. Write general character and classification of phylum
coelenterata up class with examples. 09**

OR

Q-1 a. Describe: Digestive system of Pila (with diagram). 10

**b. Write general characters and classification of phylum
Mollusca up to class with examples. 09**

Q-2 a. Describe: Nervous system of Leech (with diagram). 10

**b. Write Symptoms, Prevention and Control measure of
Malaria. 09**

OR

Q-2 Describe: a. Digestive system of Leech (with diagram). 10

b. Life cycle of Plasmodium vivex. 09

Q-3 Describe: a. Different larval stages of Liver fluke. 10

b. Ascaris (with diagram) 09

OR

Q-3 Describe: a. Reproductive system of Liver fluke. 10

b. Mite and Cattle Tick 09

Q-4 a. Explain: Pearl formation in Pearl oyster 09

b. Describe: Paragonimus westermani 09

OR

Q-4 a. Describe: Elephantiasis. 09

b. Write: Economic importance of Mollusca. 09